



# ગુજરાત દર્પણ શાન પરબ

**પુસ્તક પરિયય**

અવલોકનકાર : ડૉ. અમૃત (સુમન) હાજારી: ૭૩૨-૬૦૨-૮૩૩૮



અવલોકન : શ્રી હિમાંશુ પટેલે આ એક ‘અનેરી અને અનોખી’ કૃતિ ગુજરાતી સાહિત્યના અગ્રણીઓ એવા શ્રી યથવંત ત્રિવેદી અને શ્રી સિતાંશુ યશશેન્દ્રને અર્પણ કરેલો છે. આનંદ થયો. આ બંને સર્જકો માટે હિમાંશુ કહે છે કે ‘તેમાંને શબ્દોમાં લયોટી કવિતા પીવાવી છે તે કવાથના સર્જકો.’

સાહિત્ય સર્જનના કર્મમાં સૌથી કઠિન કર્મ કવિતાનું સર્જન કરવાનું છે. કવિતરિકે પોતાની જતને જીવવાનું છે. નવલકથા લખવી, ટૂંકી વાર્તા લખવી, નિબંધ લખવો કે પછી કોઈ પાણ ગઘનું સર્જન કરવું એ કવિતાના, પદ્ધના સર્જન કરતાં સહેલું છે. કવિ થોડા છંદોબધ્ય કે અછાંદસ કૃતિમાં થોડી પંક્તિઓમાં... જીવનદર્શનને દ્વારી દે છે. કવિતાનું આજ સર્જન ગઘની ઝોડ્યાશું કૃતિ, પાનાઓ ભરીને પાણ સંપૂર્ણ રીતે સર્જ શકતી નથી હોયી. શ્રી પટેલના મત, અનુવાદ સર્જન નથી અનુભવ છે. અનુવાદ સર્જન નથી ટ્રાન્સલેટ ભાષા છે. (ટ્રાન્સલેટ=ચરીયાની? ટપી જય તેવી?) અનુવાદ કવિતાનું પુનઃસર્જન નથી કેવળ ભાષાની ફેરબદલી છે: જે તે ભાષાની લાક્ષણિકતા અને મયર્દા સાથે...

ધૂમકેતુએ રવિન્દ્રનાથ ટાગોરની, ગીતાંજલિનો ભાવનુવાદ કરેલો છે. ધૂમકેતુની પ્રસ્તાવના થોડા શબ્દો શ્રી હિમાંશુ પટેલના પુસ્તક માટે પાણ લાગુ પાડી શકાય એમ છે, પરંતુ શ્રી પટેલ, તેમાંગે દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ કરેલો છે, એમ કહે છે. ભાવનુવાદ અને અનુવાદ વચ્ચે આસમાન જમીનનો તફાવત હોય છે. ધૂમકેતુ કહે છે કે .... જીબાનના શબ્દો અને જીવનની આ ઝૂભી તો નિહાળો ! માણસને મળેલાં રાગ, દેખ, પ્રેમ, આનંદ, દયા, કોથ, મોહ, ત્યાગ એવી એવી અનેકવિધ વૃત્તિઓ કૂલગૂંથાળીમાંથી, એને પોતાનું ગીત મેળવવાનું છે. (જીબાનની જીવનવાટિકામાંથી) એક ભાષાના એક શબ્દનો તદ્દન સમાનાધી.... નજીકના ભાવોને પ્રમાણાંતો શબ્દ બીજી ભાષામાં કદાચ જ મળે છે. એટલે જ ટ્રાન્સમાઇશેન-ભાવનુવાદ બની રહે છે.. અનુવાદ નહિ. આ પુસ્તકના પ્રાસ્તવિકમાં શ્રી પટેલના હેરેક શબ્દો તોલીને અને સરળતા પૂર્વ વાગ્યેલા છે. આ હેરેક વાક્યો ‘વિવેચન અને તત્વજ્ઞાનથી’ ભરેલા છે. શ્રી પટેલ ઉર્દુ વર્ણની મૌની તપણ્ણા, પોતાના વિશાળ અભ્યાસ અને ઊર્ધ્વ અભ્યાસ પછી આપાણી સમક્ષ એક અભ્યાસુ સાક્ષર તરીકે ઉભરે છે. ‘એ કવિતા પર્યામ છે અસ્તિત્વ માટે’ લખીને શ્રી પટેલે ગુજરાતી સાહિત્યને ખૂબ ‘શીચ’-ધનિક, કિંમતી, ફળકૃપ, દળદાર, પ્રતિષ્ઠિત,

આબર્દદાર પુસ્તકની બેટ આપી છે. આજે ભાગેજ એવા સાહિત્યકાર હશે કે જેમાંગ થાઈલેન્ડ, મોંગોલીયન, ફેન્ચ, વિયેટનામી, કોરીયન, હંગેરીયન, બિટીશ, યુરોપ, આલબેનીયા, મેસેડાનિયા, આર્નેનીના, સ્પેન્ન, સ્વિટન્ઝરલેન્ડ, ઈરાક, ટક્કી, સર્બીયન, મેક્સિકોન, અમેરીકન, વિ.વિ. દેશોના સાહિત્ય અને કવિતાઓથી ગુજરાતી સાહિત્યને અને તેના ચાહકોને ઓળખાગુણ કરાવી હોય. ગુજરાતી સાહિત્ય માટે એક અમૃત્ય નજરાણું.

મૂળ ભાષામાં સંયેલી કવિતા અને તેનો ભાવનુવાદ જે સાથે સાથે છાપાય હોત તો આ પ્રયત્ન વધુ કિમતી બની શકે એવું હું માનું છું.

ગુજરાતી સાહિત્યના સૂત્રધારો કે કાર્યકૃતિઓ કે પ્રેમીઓ ઉંઘો, જાગો અને શ્રી પટેલને પગલે ચાલો. આટલી આટલી ભાષાઓ ઉપર પ્રબુત્વ પાચીને તે ભાષાના સર્જનને પોતાની માતૃભાષા-ગુજરાતીમાં ભાવનુવાદિત કરીને, તેને દુનિયાના સાહિત્યનો રસ પાવો એ એક જેવું તેવું પ્રદાન નથી. શ્રી પટેલને લાખો અભિનંદન અને તેમનો પર્યામ આભાર માનવો જ રહ્યો. ગુજરાતી સાહિત્ય પરિષ્ઠદે, તત્ત્વ રહીને શ્રી હિમાંશુ પટેલનો આભાર માનીને તેમને યોગ્ય માનથી નવાજ્યા જ રહ્યા. શ્રી પટેલનું એક અનેરું પ્રદાન. મેસેડોનિયાના કવિશ્રી મિલેશ જ્યોર્જ નૌકોલાની કવિતા-પુરાસુખોનો ઉપોદ્ઘાતના ભાવનુવાદને માણીને શ્રી પટેલને અભિનંદન આપીએ. તેમનો હદ્યપૂર્વક આભાર માનીએ.

રોજબરોજ ઈશ્વર નકારાય છે

અમની ધ્યાપ ધસાતી જય છે

દર વર્ષ અને સદી ઓશી

અને હવે કોઈ નથી જાણું ઈશ્વર કોણ અને મનુષ્ય કોણ

માનવ મનમાં ઈશ્વર સંકોડાયેલો છે

આંગળીઓ મંદિરમાં ભીડાય છે

પરિતાપની નિશાની રૂપે

અને એની જ્વાનિમાં ચિત્કારે છે:

શું, શું તિપાયું છે મે?

ઈશ્વર અની ઉત્પત્તિ છે

કે એ ઈશ્વરની ઉત્પત્તિ છે

પાણ એ જુબે છે....

ઈશ્વર...તું કયાં છું?

હેરેક સાહિત્ય પ્રેમીએ અચૂક વાંચીને દુનિયાભરના સાહિત્યનો રસાસ્વાદ કરવો હોય તો વાંચો... ‘એક કવિતા પર્યામ છે અસ્તિત્વ માટે.’